

MURAE ORGANISOR LIMITED

(Formerly known as Earum Pharmaceuticals Limited)

CIN: L24230GJ2012PLC071299

Regd. Office: Block-B, Office No. 702, Dev Auram, Anandnagar Char Rasta, Jodhpur Char Rasta,
Ahmedabad, Ahmedabad City, Gujarat, India - 380 015

E-mail: earumpharma@gmail.com **Website:** www.muraeglobal.com

Date: 11th September, 2025

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir / Ma'am,

Subject: Submission of Newspaper Advertisement for Notice of AGM, Book Closure & E-voting

Ref: Security Id: MURAE / Code: 542724

We hereby enclose herewith copies of the public notice of the 13th Annual General Meeting of the Company and Information on Book Closure and E-voting, published on 11th September, 2025 in the following newspapers:

1. English Newspaper – The Financial Express Newspaper and
2. Regional Language Newspaper (Gujarati) – Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You,

For Murae Organisor Limited

(Formerly known as Earum Pharmaceuticals Limited)

Nitinkumar Ashokkumar Tomar

Director

DIN: 10820263

MURAE ORGANISOR LIMITED

CIN: L24230GJ2012PLC071299

Registered Office: 2 Block-B, Office No. 702, Dev Auram, Anandnagar Char Rasta, Jodhpur Char Rasta, Ahmedabad, Ahmedabad City, Gujarat, India - 380 015 | Phone: +91 7600266677
Email: earumpharma@gmail.com | Website: www.murae-global.com

NOTICE OF THE 13TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that:

- The 13th Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Tuesday, 30th September, 2025 at 1:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio/Video Means ("OAVM") to transact the ordinary and special businesses as set out in the notice of AGM.
- As per SEBI Circular dated 12th May, 2020, Physical Copy of the Annual Report for the 13th AGM inter-alia is not required to be sent; therefore, Annual Report is being sent only through electronic mode to those Members as on 5th September, 2025, whose email addresses are registered with the Company / Depositories. Members whose E-mail id is not registered / updated can register / update their e-mail address.
- The Notice of 13th AGM and Annual Report for Financial Year 2024-25 will also be made available on the Company's website at www.murae-global.com, website of stock exchange i.e. BSE Limited at www.bseindia.com.
- Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made thereunder and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the register of Members and Share Transfer Book of the Company will remain closed from Tuesday, 23rd September, 2025 to Tuesday, 30th September, 2025 (both days inclusive) for purpose of 13th Annual General Meeting.
- As per Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and clause 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide the members the facility to cast their votes electronically from a place other than the venue of the AGM (remote E-voting) on all resolutions set forth in the Notice, for which the Company has engaged the services of National Securities Depository Limited as the E-voting agency. All the members are informed that:
 - A. The Ordinary and Special Businesses as set out in the notice of AGM may be transacted through voting by electronic means.
 - B. The remote e-voting shall commence on 27th September, 2025 at 09:00 A.M. & shall end on 29th September, 2025 at 05:00 P.M.
 - C. The cut-off date for determining the eligibility to vote by electronic means or at AGM is Tuesday, 23rd September, 2025.
 - D. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date i.e. Tuesday, 23rd September, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.
- Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) E-voting facility shall be available after AGM for those who have not voted; c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.
- The Company has appointed M/s. Jay Pandya & Associates, Practicing Company Secretaries, Ahmedabad as the Scrutinizer to scrutinize the E-voting process in fair and transparent manner.
- Any Query or grievance connected with the remote e-voting may be addressed to the Company Secretary of the Company at E-mail earumpharma@gmail.com or you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 for any further clarification.

For Murae Organisor Limited
(Formerly known as Earum Pharmaceuticals Limited)Sd/-
Chinmay Shrikant Pradhan
Managing Director
DIN: 10753724

Date: 10/09/2025

Place: Ahmedabad

SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

CIN: L45201GJ1992PLC093662

Reg. Off.: 1309, 13th Floor, D & C Phoenix, Opp. Aanal Flat, Vijay Cross Road, Navrangpura, Ahmedabad, Gujarat, India, 380009
Email Id: sharanaminfaproject@gmail.com, Contact No: 079-29707666
Website: www.sharanaminfra.com

NOTICE OF THE 33RD ANNUAL GENERAL MEETING OF THE COMPANY, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that:

- The 33rd Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Tuesday, 30th September, 2025 at 5:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio/Video Means ("OAVM") to transact the ordinary and special businesses as set out in the notice of AGM.
- As per SEBI Circular dated 12th May, 2020, Physical Copy of the Annual Report for the 33rd AGM inter-alia is not required to be sent; therefore, Annual Report is being sent only through electronic mode to those Members as on 1st September, 2025, whose email addresses are registered with the Company / Depositories. Members whose E-mail id is not registered / updated can register / update their e-mail address.
- The Notice of 33rd AGM and Annual Report for Financial Year 2024-25 will also be made available on the website of stock exchange i.e. BSE Limited ("BSE") at www.bseindia.com.
- Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made thereunder and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the register of Members and Share Transfer Book of the Company will remain closed from Tuesday, 23rd September, 2025 to Tuesday, 30th September, 2025 (both days inclusive) for purpose of 33rd Annual General Meeting.
- As per Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and clause 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide the members the facility to cast their votes electronically from a place other than the venue of the AGM (remote E-voting) on all resolutions set forth in the Notice, for which the Company has engaged the services of National Securities Depository Limited as the E-voting agency. All the members are informed that:
 - A. The Ordinary and Special Businesses as set out in the notice of AGM may be transacted through voting by electronic means.
 - B. The remote e-voting shall commence on 27th September, 2025 at 09:00 A.M. & shall end on 29th September, 2025 at 05:00 P.M.
 - C. The cut-off date for determining the eligibility to vote by electronic means or at AGM is Tuesday, 23rd September, 2025.
 - D. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date i.e. Tuesday, 23rd September, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.
- Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) E-voting facility shall be available after AGM for those who have not voted; c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.
- The Company has appointed M/s. Jay Pandya & Associates, Practicing Company Secretaries, Ahmedabad as the Scrutinizer to scrutinize the E-voting process in fair and transparent manner.
- Any Query or grievance connected with the remote e-voting may be addressed to the Company Secretary of the Company at E-mail sharanaminfaproject@gmail.com or you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 for any further clarification.

For Sharanan InfraProject and Trading Limited

Sd/-
Pratikkumar Samjibhai Bhalodiya
Managing Director
DIN: 10818984

Date: 10/09/2025

Place: Ahmedabad

CAPRI GLOBAL CAPITAL LIMITED

Registered & Corporate Office:- 502, Tower-A, Peninsula Business Park, Senapati Bapat Marg, Lower Patel, Mumbai-400013

Circle Office : 9-B, 2nd floor, Pusa Road, Rajinder Place, New Delhi-110060

APPENDIX - IV-A [See proviso to rule 8 (6) and 9 (1)]**Sale notice for sale of immovable properties**

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Constructive/physical possession of which has been taken by the Authorised Officer of Capri Global Capital Limited Secured Creditor, will be sold on "As is where is", "As what is", and "Whatever there is" on dates below mentioned, for recovery of amount mentioned below due to the Capri Global Capital Limited Secured Creditor from Borrower mentioned below. The reserve price, EMD amount and property details mentioned below.

SR. NO.**1. BORROWER(S) NAME****DESCRIPTION OF THE MORTGAGED PROPERTY****2. OUTSTANDING AMOUNT**

1. DATE & TIME OF E-AUCTION	2. LAST DATE OF SUBMISSION OF EMD	1. RESERVE PRICE
3. DATE & TIME OF THE PROPERTY INSPECTION	2. LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC	2. EM'S OF THE PROPERTY INCREMENTAL VALUE
1. E-AUCTION DATE: 30.09.2025 (Between 3:00 P.M. to 4:00 P.M.)	1. RESERVE PRICE Rs. 7,00,000/- (Rupees Seven lacs Only)	RESERVE PRICE
2. LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC: 29.09.2025	2. EARNEST MONEY DEPOSIT: Rs. 70,000/- (Rupees Seventy Thousand Only)	EARNEST MONEY DEPOSIT
3. DATE OF INSPECTION: 27.09.2025	INCREMENTAL VALUE: Rs. 5,000/- (Rupees Five Thousand Only)	INCREMENTAL VALUE: Rs. 5,000/- (Rupees Five Thousand Only)

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Capri Global Capital Limited Secured Creditor's website i.e. www.capriglobal.in/auction/**TERMS & CONDITIONS OF ONLINE E-AUCTION SALE:-**

- The Property is being sold on "AS IS WHERE IS, WHATEVER THERE & WITHOUT RE COURSE BASIS". As such sale is without any kind of warranties & indemnities.
- Particulars of the property / assets (viz. extent & measurements specified in the E-Auction Sale Notice) has been stated to the best of information of the Secured Creditor and Secured Creditor shall not be answerable for any error, misstatement or omission. Actual extent & dimensions may differ.
- E-Auction Sale Notice issued by the Secured Creditor is an invitation to the general public to submit their bids and the same does not constitute and will not be deemed to constitute any commitment or may representation on the part of the Secured Creditor. Interested bidders are advised to peruse the copies of title deeds with the Secured Creditor and to conduct own independent enquiries /due diligence about the title & present condition of the property / assets and claims / dues affecting the property before submission of bids.
- Auction/bidding shall only be through "online electronic mode" through the website <https://sarfaesi.auctiontiger.net> Or Auction Tiger Mobile APP provided by the service provider M/S eProcurement Technologies Limited, Ahmedabad who shall arrange & coordinate the entire process of auction through the e-auction platform.
- The bidders may participate in e-auction for bidding from their place of choice. Internet connectivity shall have to be ensured by bidder himself. Secured Creditor /service provider shall not be held responsible for the internet connectivity, network problems, system crash own, power failure etc.
- For details, help, procedure and online bidding on e-auction prospective bidders may contact the Service Provider M/S e-Procurement Technologies Ltd. Auction Tiger, Ahmedabad (Contact no. 079-61200531/576/596/597/598/597/594/), Mr. Ramprasad Sharma Mob. 800-002-3297/ 79-6120 0559. Email: ramprasad@auctiontiger.net.
- For participating in the e-auction sale the intending bidders should register their name at <https://sarfaesi.auctiontiger.net> well in advance and shall get the user id and password. Intending bidders are advised to change only the password immediately upon receiving it from the service provider.
- For participating in e-auction, intending bidders have to deposit a refundable EMD of 10% of RESERVE PRICE (as mentioned above) shall be payable by interested bidders through Demand Draft/NEFT/RTGS in favor of "Capri Global Capital Limited" on or before 29-Sept-2025.
- The intending bidders should submit the duly filled in Bid Form (format available on <https://sarfaesi.auctiontiger.net>) along with the Demand Draft remittance towards EMD in a sealed cover addressed to the Authorized Officer, Capri Global Capital Limited Regional Office - 9th floor, BBC Tower, Broadway Business Centre, Near Law Garden Circle Netaji Road, Ellisbridge, Ahmedabad, Gujarat-380009 dated on 29-Sept-2025. The sealed cover should be super scribed with "Bid for participating in E-Auction Sale, - in the Loan Account No. _____" (as mentioned above) for property of "Borrower Name".
- After expiry of the last date of submission of bids with EMD, Authorised Officer shall examine the bids received by him and confirm the details of the qualified bidders (who have quoted their bids over and above the reserve price and paid the specified EMD with the Secured Creditor) to the service provider M/S eProcurement Technologies Limited to enable them to allow only those bidders to participate in the online inter-se bidding / auction proceedings at the date and time mentioned in E-Auction Sale Notice.
- Inter-se bidding among the qualified bidders shall start from the highest bid quoted by the qualified bidders. During the process of inter-se bidding, there will be unlimited extension of '10' minutes each, i.e. the end time of e- auction shall be automatically extended by 10 Minutes each time if bid is made within 10 minutes from the last extension.
- Bids once made shall not be cancelled or withdrawn. All bids made from the user id given to bidder will be deemed to have been made by him alone.
- Immediately upon closure of E-Auction proceedings, the highest bidder shall confirm the final amount of bid quoted by him BY E-Mail both to the Authorised Officer, Capri Global Capital Limited, Regional Office 9th floor, BBC Tower, Broadway Business Centre, Near Law Garden Circle Netaji Road, Ellisbridge, Ahmedabad, Gujarat-380009 and the Service Provider for getting declared as successful bidder in the E-Auction Sale proceedings.
- The successful bidder shall deposit 25% of the bid amount (including EMD) within 24 Hour of the sale, being knocked down in his favour and balance 75% of bid amount within 15 days from the date of sale by DD/Pay order/NEFT/RTGS/Chq favouring Capri Global Capital Limited.
- In case of default in payment of stipulated amounts by the successful bidder / auction purchaser within the stipulated time, the sale will be cancelled and the amount already paid (including EMD) will be forfeited and the property will be again put to sale.
- At the request of the successful bidder, the Authorised Officer in his absolute discretion may grant further time in writing, for depositing the balance of the bid amount.
- The Successful Bidder shall pay 1% of Sale price towards TDS (out of Sale proceeds) and submit TDS certificate to the Authorised officer and the deposit the entire amount of sale price (after deduction of 1% towards TDS), adjusting the EMD within 15 working days of the acceptance of the offer by the authorized officer, or within such other extended time as deemed fit by the Authorised Officer, failing which the earnest deposit will be forfeited.
- Municipal / Panchayat Taxes, Electricity dues (if any) and any other authorities dues (if any) has to be paid by the successful bidder before issuance of the sale certificate. Bids shall be made taking into consideration of all the statutory dues pertaining to the property.
- Sale Certificate will be issued by the Authorised Officer in favour of the successful bidder only upon deposit of entire purchase price / bid amount and furnishing the necessary proof in respect of payment of all taxes/charges.
- Applicable legal charges for conveyance, stamp duty, registration charges and other incidental charges shall be borne by the auction purchaser.
- The Authorized officer may postpone / cancel the E-Auction Sale proceedings without assigning any reason whatsoever. In case the E-Auction Sale scheduled is postponed to a later date before 15 days from the scheduled date of sale, it will be displayed on the website of the service provider.
- The decision of the Authorised Officer is final, binding and unquestionable.
- All bidders who submitted the bids, shall be deemed to have read and understood the terms and conditions of the E-Auction Sale and be bound by them.
- Moveable Article (If any) lying in the property is not part of this sale.
- For further details and queries, contact Authorised Officer, Capri Global Capital Limited: Mr. Prabhat Barolia Mo. No. 9799395860.
- This publication is also 15 (Fifteen) days notice to the Borrower / Mortgagor / Guarantors of the above said loan account pursuant to rule 8(6) AND 9(1) of Security Interest (Enforcement) Rules 2002, about holding of auction sale on the above mentioned date / place.

Special Instructions / Caution: Bidding in the last minutes/seconds should be avoided by the bidders in their own interest. Neither Capri Global Capital Limited nor the Service Provider will be responsible for any lapses/failure (Internet failure, Power failure, etc.) on the part of the bidder in such cases. In order to ward off such contingent situation, bidders are requested to make all the necessary arrangements / alternatives such as back-up power supply and whatever else required so that they are able to circumvent such situation and are able to participate in the auction successfully.

Place : GUJARAT Date : 11-Sept-2025

Sd/- (Authorised Officer) Capri Global Capital Ltd.

AXIS BANK	Branch Office: Axis Bank Limited, Collection Center, First Floor, Unit No.101 & 102 (Part) Balleswar Avenue S G Highway Opp. Rajpath Club Bodakdev Ahmedabad Gujarat - 380 054. Corporate Office: Axis Bank Ltd., 3rd Floor, Gipalex, NPC - 1, TTC Industrial Area, Mugalsan Road, Airoli, Navi Mumbai - 400 708.
------------------	---

Demand Notice

We, Axis Bank Ltd. (formerly known as UTI Bank Ltd.) (hereinafter referred to as "The Bank") having its Registered Office at Trishul, Opp. Samarthswar Temple, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006 among other places Axis Bank Ltd., 1st Floor, Balleswar Avenue, S G Highway, Opp. Rajpath Club, Badakdev, Ahmedabad, Gujarat - 380054 and do hereby give the notice under Section 13(2) of the aforesaid Act in its capacity as Secured Creditor, Whereas the Borrowers / Mortgagors mentioned hereunder had availed the financial assistance from Axis Bank Ltd. We state that despite having availed the financial assistance, The Borrowers / Mortgagors / have committed defaults in repayment of interest and principal amounts as per due dates. The Account have been classified as Non Performing Asset on the date mentioned hereunder in accordance with the directions / Guidelines issued by reserve bank of India. Consequently to the Authorised Officer of Axis Bank Ltd. under Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice to borrowers / co - Borrowers / Mortgagors / on the dates mentioned herein below under Section 1

